

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યું., દાહોદ ખાતે યોજાયેલ "ખાતરના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ" કાર્યક્રમની ઉજવણી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ અને આત્મા પ્રોજેક્ટ, દાહોદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૨.૧૦.૨૦૧૯ના રોજ કૃષિ ઇજનેરી પોલીટેકનિક, કોલેજ, દાહોદના સેમિનાર ખંડમાં "ખાતરના યોગ્ય ઉપયોગ" અંગેની જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કૃષિ સાથે સંકળાયેલ ૩૧૮ પ્રગતિશીલ ખેડુત બહેનોએ ભાગ લીધેલ. સદર કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ડો.એમ.એમ. ત્રિવેદી, આચાર્યશ્રી, કૃષિ ઇજનેરી પોલીટેકનિક, મુવાલીયા ફાર્મ, દાહોદ, મુખ્ય મહેમાનશ્રીઓ શ્રી સી. એમ. પટેલ, નાયબ ખેતી નિયામક, શ્રી એચ. બી. પારેખ, નાયબ બાગાયત નિયામક, શ્રી જે.જે. પટેલ, મદદનીશ ખેતી નિયામક, શ્રી આર. જી. પટેલ, જી. એન.એફ.સી., શ્રી એ.બી. ધાંગા, ડી.પી.ડી., આત્મા પ્રોજેક્ટ તેમજ કેવિકે, દાહોદના તમામ વૈજ્ઞાનિક તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત કરતાં શ્રી એચ.એલ.કાયા, વૈજ્ઞાનિક(બાગાયત) દ્વારા ઉપસ્થિત સર્વેનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય મહેમાનશ્રીઓ દ્વારા દ્વિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરેલ. વધુમાં તેમના દ્વારા બાગાયત પાકોમાં ખાતરના યોગ્ય ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી. શ્રી એન. કે. રાહોડ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા પ્રસંગને અનુરૂપ માહિતી સાથે જમીન ચકાસણી, ખાતરના ભલામણ મુજબ ઉપયોગ તેમજ ખાતરના યોગ્ય વપરાશથી વિવિધ પાકોમાં રોગ જીવાતના ઉપદ્રવના અસરકારક નિયંત્રણ અંગે માહિતી આપવામાં આવી. શ્રી ગૌરાંગ ભાભોર, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા જિલ્લાના ખેડૂતોમાં ખાતરના યોગ્ય વપરાશ બાબતમાં જાગૃતિ કેળવાય, ખાતરના યોગ્ય વપરાશ અંગેની તજજ્ઞતાનો પ્રચાર પ્રસાર થાય તે બાબત પર ભાર મૂકવા અપીલ કરવામાં આવી. કાર્યક્રમનો લય જાળવતાં અને સહજ સમજ માટે ઉપસ્થિત બહેનોને ખાતરના યોગ્ય વપરાશ અંગેની વિડિયો ફિલ્મ દર્શાવવામાં આવી. કાર્યક્રમના હાર્દ તરફ પ્રયાણ કરતા બપોરે ૧૨:૦૦ કલાકે ખેડૂતો માટે ખાતરના યોગ્ય ઉપયોગ અંગેના જાગૃતિ કાર્યક્રમના ઉદ્ઘાટનનું જીવંત પ્રસારણ સર્વે ઉપસ્થિત ખેડૂતો સમક્ષ દેખાડવામાં આવ્યું. જેમા માન. મંત્રીશ્રી(રાજ્યકક્ષા), પરસોત્તમ રૂપાલા, માન. મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર, તથા માન. મંત્રીશ્રી, રસાયણ અને ખાતર શ્રી સંદાનંદ ગોડવાએ જીવંત પ્રસારણ દ્વારા ખેડૂતોને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગકરવા માટે અપીલ કરેલ. કાર્યક્રમના

અંતમાં કેવીકે, દાહોદના સ્ટાફ દ્વારા સર્વે ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી



કાર્યક્રમની ઝલક